

સૈનિક સ્કૂલ બાલાચડી
અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2017
પસંદગી યાદી (લેખિત પરીક્ષા,મેડીકલ ફિટનેશ અને મૌખિક પરીક્ષા)
ઘોરણ 6 અને 9
શૈક્ષણિક સત્ર 2017-18

માતા-પિતા/વાલીઓ માટે ખાસ સૂચના

વાલીઓને ખાસ વિનંતી છે કે તેઓ ખોટા માર્ગદર્શન કે પ્રલોભનથી સાવધાન રહે. સ્કૂલ દ્વારા આપવામાં આવતું એડમિશન મેરીટ અને મેડીકલ ફિટનેશના આધારે આપવામાં આવે છે. આમ છતાં આવી કોઈ ગેરમાર્ગે દોરનાર બાબત આપના ધ્યાનમાં આવે તો સ્કૂલ સંચાલનને જાણ કરવા વિનંતી.

- (1) ઉમેદવારની આ પ્રવેશ પરીક્ષા પસંદગીયાદીમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓના રોલનંબર આપવામાં આવ્યા છે. તેમના રોલનંબરની આગળ કોડ **SS04** ધ્યાનમાં લેવો.
- (2) આ પસંદગીયાદીમાં રોલનંબર રાજ્ય/પ્રાંતના આધારે દર્શાવવામાં આવેલ છે જેથી વાલીઓને રીપોર્ટિંગ કરવામાં સરળતા રહે. આ પસંદગીયાદીમાં કોઈ અગ્રમતા ક્રમને ધ્યાનમાં લીધેલ નથી.
- (3) પસંદગી પામેલ ઉમેદવારોના વાલીઓને વિનંતી કે તેઓ એડમિશનની નિર્ધારિત તારીખ અને સમયે તમામ પ્રકારના ઓરીજનલ પ્રમાણપત્રો તથા તેમની ખરી નકલ (પ્રમાણિત નકલ) સાથે લાવવી.
- (4) એડમિશન માટેનો કોલ-લેટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. આમ છતાં જો કોઈ કારણોસર કે કોલ-લેટર ન મળેતો ઉમેદવારના વાલીઓએ સ્કૂલ વેબસાઈટ પર મુકેલ પસંદગી યાદીમાં આપવામાં આવેલ તારીખ અને સમયે પહોંચી જવું જેથી પ્રવેશ પ્રક્રિયા સમસર પૂર્ણ કરી શકાય.
- (5) ઉંમરના પુરાવા માટેનું જન્મપ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન / રજીસ્ટ્રાર ઓફિસ દ્વારા આપવામાં આવેલું હોવું જોઈએ. ડેફેન્સ કેટેગરી / એક્સ સર્વિસમેન માટે પાર્ટ-2 ના ઓર્ડર પ્રમાણે સીઓ/ઓસી દ્વારા આપેલ પ્રમાણપત્ર ઉંમરના પુરાવા માટે માન્ય રહેશે. માન્ય ડોક્યુમેન્ટ જમા નહીં કરેલા હોય ત્યાં સુધી પ્રવેશ કામચલાઉ રહેશે.
- (6) વાલીઓને વિનંતી છે કે પ્રવેશ પ્રક્રિયા માટેના ભાગ રૂપે આપવામાં આવેલ યાદી મુજબના ડોક્યુમેન્ટ્સ જેમ કે જન્મપ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર તારીખ 15 એપ્રિલ 2017 સુધીમાં જમા કરવા વિનંતી છે. જો સમયસર આ ડોક્યુમેન્ટ્સ જમા કરવામાં નહીં આવે તો એડમિશન કેન્સલ થશે અને પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ પછીના ઉમેદવારને એડમિશન આપવામાં આવશે.
- (7) આ સ્કૂલ અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે આથી વાલીઓને વિનંતી છે કે તેઓ વેકેશન દરમિયાન પોતાના સંતાનને અંગ્રેજી તથા હિંદી ભાષાનું સામાન્ય જ્ઞાન આપવા માટે બનતો પ્રયાસ કરે.